

તात्कालिक

ક્રમાંક: મક્કમ/૧૦૨૦૦૬/૨૮૭૫/૬  
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ  
સચિવાલય, ગાંધીનગર

તારીખ:-

6 JAN 2009

માટ્યુ.બો. રોડી

12 JAN 2009

ક્રમાંક..... ૧/૧૯૪૫૦

શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ  
સચિવાલય, ગાંધીનગર

પ્રતિ,

- સંયુક્ત સચિવશ્રી(ન.આ.)
- નાયબ સચિવશ્રી(સંકલન)
- નાયબ સચિવશ્રી(પ્રોજેક્ટ)
- નાયબ સચિવશ્રી(શ.વિ.અને મહેકમ)
- નાયબ સચિવશ્રી(ન.પા.)
- ખા.ફ..અધિ. અને હોદાની નાયબ સચિવશ્રી  
(એપેલેટ ઓથોરેટી)
- ઉપસચિવશ્રી (શ.વિ.અ. ને મહેકમ)
- ઉપસચિવશ્રી (સંકલન)
- ઉપસચિવશ્રી (પ્રોજેક્ટ, બજેટ, ગૃહનિર્માણ)
- ઉપસચિવશ્રી (ન.પા.)
- જુની.ટાઉન પ્લાનરશ્રી (લ-શાખા)  
(જલેર માહિતી અધિકારીશ્રીઓ)
- મુખ્ય નગર નિયોજકશ્રી,  
ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
- નગરપાલિકા નિયામકશ્રી,  
ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
- હાઉસીંગ કમિશનરશ્રી,  
ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમદાવાદ.
- મ્યુનિસિપલ કમિશનરશ્રી,  
મહાનગર સેવા સંદર્ભ,  
અમદાવાદ, વડોદરા, રાજકોટ,  
સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ
- મુખ્ય કારોબારી અધિકારીશ્રી,  
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ,  
ગાંધીનગર.
- મેનેજરિંગ ડિરિક્ટરશ્રી,  
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પની,  
ગાંધીનગર

T-માયા

ઠન્ડક નં..... ૧.....  
સાલ..... ૨૦૦૮, તારીખ.....  
સુરત મંદિરપાલિકા

115

12 JAN 2009

૧/૧૮  
૦૧-૦૧A.M.O/K.P.O.  
(R.T.I cell)

MC/SMG

સાલ ૨૦૦૮  
તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૦૯  
સુરત મંદિરપાલિકા  
સુરત ૨૦૦૯

- મીરાન ડાયરેક્ટરશી,  
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મીરાન,  
ગાંધીનગર,
- મુખ્ય કારોબારી અધિકારીશી,  
શહેરી/વિસ્તાર વિકાસ સત્તામંડળ,  
અમદાવાદ/ ગાંધીનગર/ સુરત/ અમલગર/  
વડોદરા/ ભાવનગર/રાજકોટ/બૂજી/અંણવાડ/રાય્દુર

**વિષય:-** માહિતીનો અધિકાર અધિન્યાત્ર-૨૦૦૫.

કોમાન,

ઉપરોક્ત વિષય અન્વયે સામાન્ય વહીવટ વિભાગના તા.૨૦/૧૨/૨૦૦૮ ના પત્ર ક્રમાંક: આરટીઆઈ/૨૦૦૭/૪૫૭૨૭૭(ભા.સ.) આરટીઆઈસેલની નકલ તેના બિડાણ સાથે સામેલ રાખી જરૂરી કાર્યવાહી સાકુ આશાનુસાર મોકલી આપવામાં આવે છે.

આપનો વિશ્વાસુ



સેક્શન અધિકારી

શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ

બિડાણ:ઉપર મુજબ.

ક્રમાંક : આરટીઆઈ/૨૦૦૭/૪૫૭૨૮૭(ભા.સ.)/આરટીઆઈસેલ,  
સામાન્ય વહીવટ વિભાગ,  
સચિવાલય, ગાંધીનગર.  
તારીખ : ૨૦-૧૨-૨૦૦૮.

પ્રતિ,

૧. માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજ્યભવન, ગાંધીનગર.
૨. અધિક મુખ્ય સચિવશ્રી / અગ્ર સચિવશ્રી / સચિવશ્રી, સચિવાલયના સર્વે વિભાગો
૩. સચિવશ્રી, ગુજરાત વિદ્યાનિયમના સચિવાલય, ગાંધીનગર.
૪. સચિવશ્રી, ગુજરાત માછિતી આયોગ, સેક્ટર-૧૮, ગાંધીનગર.
૫. સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ.
૬. સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર.
૭. રજીસ્ટ્રારશ્રી, ગુજરાત રજીસ્ટ્રોકોર્ટ, અમદાવાદ.
૮. સચિવશ્રી, ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ, ગાંધીનગર.
૯. સચિવશ્રી, ગુજરાત ગૌરી સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.
૧૦. સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, અમદાવાદ.
૧૧. ડેપ્યુટી કાયરેક્ટર જનરલશ્રી, સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્થા, અમદાવાદ.
૧૨. સર્વે જિલ્લા કલેક્ટરશ્રી.
૧૩. સર્વે જિલ્લા વિકાસ અધિકારીશ્રી.

૨૯ DEC 2008

૫૯૬૬૦૮  
૬૦૭૪૧૦૮

શ્રીમાન

વિષય: માછિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ હેઠળ કરવામાં આવેલ પ્રથમ અપીલના નિકાલ બાબતે એપેલેટ ઓથોરીટીએ અનુસરવાની થતી કાર્ય પદ્ધતિ અને તેના હુકમનો અમલ જાહેર માછિતી અધિકારીએ કરવા અંગે.

ઉપર્યુક્ત વિષય પરતે જાણવવાનું કે, આર. ટી. આઈ. એકટ હેઠળ કરવામાં આવેલ પ્રથમ અપીલના નિકાલ બાબતે એપેલેટ ઓથોરીટીએ કઈ કાર્યવાહી અનુસરવી તથા એપેલેટ ઓથોરીટીએ કરેલ નિર્ણય/હુકમનું પાલન સંબંધકર્તા જાહેર માછિતી અધિકારીએ અચૂક કરવાનું રહેશે અને તે બાબતમાં કસૂર થયે જાહેર માછિતી અધિકારી વિરુદ્ધ પગલા લેવા અંગેની જરૂરી સુચનાઓ ભારત સરકારશ્રીના ભિનિસ્કી ઓફ પર્સોનલ, પણિલક ગ્રિવન્સિસ એન્ડ પેન્શનશના તા. ૮/૭/૨૦૦૭ના ઓફિસ મેમોરન્ડમ ક્રમાંક: ૧૦/૨૩/૨૦૦૭ - આઈઆર, અન્વયે આંપવામાં આવેલ છે. ભારત સરકારશ્રીની સદરહુક સુચનાની ગુજરાતી અનુવાદ ની નકલ આ સાથે સામેલ રાખેલ છે.

(P.T.O.)

૩/૧૯૨૧૮

૩૫૦૬૧૩  
૩૦/૧૧૧૬૮

સદરહુ સુચનાની જાણ આપના વિભાગના વહીવટી હક્કમતમાંના સર્વ ખાતાના વડાઓ /  
જિલ્લા / તાલુકા / ગ્રામ કક્ષાની કચેરીઓ/ બોર્ડ/ નિગમ વગેરે સહિતના સર્વ જાહેર સત્તામંડળો /  
જાહેર માહિતી અધિકારીઓ / એપેલેટ અધિકારીઓના ઘાન ઉપર પણ અચૂક લાવવા વિનંતી છે.

આપનો વિશ્વાસુ,

સી.એસ.ઉપાધ્યાય

સરકારના નાયબ સચિવ

સામાન્ય વહીવટ વિભાગ

બિડાયા: ઉપર મુજબ.

નકલ રવાના:-

૧. નાયબ સચિવશ્રી, માન. મુખ્ય મંત્રીશ્રીનું કાર્યાલય, સચિવાલય, ગાંધીનગર.
૨. નાયબ સચિવશ્રી, મુખ્ય સચિવશ્રીનું કાર્યાલય, સચિવાલય, ગાંધીનગર.
૩. સામાન્ય વહીવટ વિભાગની સર્વ શાખાઓ.
૪. ના.સે.અધિકારી સિલેક્ટ ફાઈલ.
૫. શાખા સિલેક્ટ ફાઈલ.

ક્રમાંક: ૧૦/૨૩/૨૦૦૭-આઈ.આર.

ભારત સરકાર

કર્મચારીવર્ગ, જાહેર કાન્ફિડેન્શિપ અને પેન્શન મંત્રાલય,

નવી દિલ્હી,

તા. ૮ મી જુલાઈ, ૨૦૦૭

### કચેરી યાદી

**વિષય:-** માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ પ્રથમ અપીલનો નિકાલ

આથી નીચે સહી કરનાર આજાનુસાર જણાવે છે કે કેન્દ્રીય માહિતી આયોગે આ વિભાગનું દ્વારા દોયું છે કે કેટલાક ડિસાઓમાં : -

(૧) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રથમ અપીલ અધિકારીએ, અધિનિયમ ક્રારા નિર્ધારિત સમય-મર્યાદામાં અપીલોનો નિકાલ કરતા નથી;

(૨) અપીલ અધિકારીએ અપીલોનો ન્યાયોચિત નિર્ણય કરતા નથી અને કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીના નિર્ણયને ચંત્રવત સંમતિ આપે છે;

(૩) કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીએ, અપીલ કરનારને માહિતી પૂરી પાડવા માટેની પ્રથમ અપીલ અધિકારીની સુચનાઓનું પાલન કરતા નથી;

૨. માહિતી અધિકાર અધિનિયમની તલમ-૧૬(ક) અન્યથે પ્રથમ અપીલ અધિકારીએ અપીલ મખ્યાના ત્રીસ દિવસમાં તેનો નિકાલ કરવાનો રહે છે. અપવાદરૂપ ડિસામાં, અપીલ અધિકારી અપીલ અંગે નિર્ણય લેવામાં પીલ્લાલીસ દિવસનો સમય લઈ શકે, પરંતુ તેમણે વિલંબ થવા માટેના કારણો લેજિતમાં આપવાના હોય છે. તેથી, પ્રથમ અપીલ અધિકારીએ સુનિખિત કરવું કે તેમને મળેલ અપીલનો નિકાલ ૩૦ દિવસમાં કરવો શક્ય ન હોય તો, તેના નિકાલ માટે રૂપ દિવસથી વધુ સમય જવો જોઈએ નહીં. આવા ડિસામાં, અપીલ અધિકારીએ અપીલનો ૩૦ દિવસમાં નિકાલ ન કરવા માટેનાં કારણોની લેજિતમાં નોંધ કરવી.

#### (આર્દ્ધ-નાયાધિક)

૩. માહિતી અધિકાર અધિનિયમ અન્યથે અપીલોનો નિર્ણય કરવો એ એર્ધ-નાયાધિકામગીરી છે. તેથી, અપીલ અધિકારીએ માત્ર ન્યાય મખ્યો છે એટલું જ નહીં પરંતુ ન્યાય મખ્યો હોવાની પ્રતીતિ પણ સુનિખિત કરવી જરૂરી છે. આ બાબત સુનિખિત કરવા માટે અપીલ અધિકારીનો હુકમ વિગતદર્શક (speaking order) એટલે કે તક્કિસંગત હોવો જોઈએ.

૪. અપીલ અધિકારી એવા વિષખર્ષ પર આવે કે અરજદારને કેન્દ્રીય માહિતી અધિકારી ક્રારા જે માહિતી પૂરી પાડવામાં આવી છે તે ઉપરાંત પણ વધુ માહિતી પૂરી પાડવી જરૂરી છે તો, તેઓ (૧) અરજદારને આવી માહિતી પૂરી પાડવા માટે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીને હુકમ કરી શકે છે; અથવા તો (૨) તેઓ પોતે અરજદારને આવી માહિતી આપી અપીલનો નિકાલ કરી શકે છે. પ્રથમ ડિસામાં, અપીલ અધિકારીએ એ સુનિખિત કરવું કે માહિતી પૂરી પાડવા માટે તેમણે હુકમ કર્યો છે તે મુજબની માહિતી અરજદારને તાત્કાલિક પૂરી પાડવ માં આવે. તેમ છતાં, અપીલ અધિકારી બીજા પ્રકારની કાર્યવાહી કરે અને ઉક્ત બાબતે તેમણે કરેલ હુકમની સાથે માંગેલી માહિતી તેઓ પોતે જ પૂરી પાડે તે વધુ ઉચિત રહેશે.

૫. કેન્દ્રીય માહિતી આયોગે એ બાબત પરત્યે પણ દ્વારા દોયું છે કે કેટલાંક મંત્રાલયો / વિભાગોએ ખૂલ જ જુનિયર અધિકારીઓની અપીલ અધિકારીએ તર્ફે નિમાયૂક કરી છે, જેઓ વાસ્તવમાં તેમણે કરેલ હુકમોનું પાલન કરાવી શકતા નથી. અધિનિયમમાં એવી જોગવાઈ છે કે પ્રથમ અપીલ અધિકારી, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારીથી ઉપલા દરજાના સિલિયર અધિકારી રહેશે. આમ, અધિનિયમની જોગવાઈઓ મુજબ, અપીલ

અધિકારી, કેજરીય જાહેર માહિતી અહિક રીને સૂચના આપવાની સત્તા ઘરાપતા હોવા જોઈએ. નેમ છતાં કેજરીય જાહેર માહિતી અધિકારી આપીલ અધિકારીએ કરેલા હુકમનો અમલ ન કરે અને આપીલ અધિકારીને એવું લાગે કે તેમણે કરેલ હુકમનો અમલ કરાવવા માટે ઉચ્ચ સત્તાધિકારીની દરમિયાનગીરી આવશ્યક છે તો, તેમણે "જાહેર સત્તામંડળમાં કેજરીય જાહેર માહિતી અધિકારીની વિરાસ્ત પણલાં ભરવા સંખમ અધિકારીના દ્યાન પર આ બાબત લાગવી. આવા સંખમ અધિકારી, માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈઓનો અમલ સુનિશ્ચિત કરવા સારુ જરૂરી કાર્યવાહી કરશે.

(૬) આ કચેરી-ચાટીનું વિષયપસ્તુ તમામ સંબંધિતોના દ્યાન પર લાવવું.

સહી,

(ક.જ.વમી)

નિયામક

પ્રતિ

- (૧) ભ રત સરકારનાં બધાં મંત્રાલયે / વિભાગો.
  - (૨) સંઘ જાહેર સેવા આયોગ/લોકસભા સ ચેવાલય/રાજ્યસભા સચિવાલય/કેબિનેટ સચિવાલય/કેજરીય તકેદારી આયોગ/રાષ્ટ્રપતિ સચિવાલય/ઉપ રાષ્ટ્રપતિ સચિવાલય/વડાપ્રધાનનું કાર્યાલય/રાયોજન પંચ/ચુંટણી આયોગ.
  - (૩) કર્મચારી પસંદગી આયોગ, સી.જી.ઓ. કોમ્પ્લેક્સ, નવી દિલ્હી.
  - (૪) બારતના કોમ્પ્લોલર અને ઓફિટર જનરલની કચેરી, ૧૦, બહાદુરશાહ ક્રિકેટ માર્ગ, નવી દિલ્હી.
  - (૫) કર્મચારીઓ અને તાલીમ વિભાગ તથા પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના તમામ અધિકારીઓ/કેસ્ક/અનુભાગો.
- નકલ રવાના:— બધાં રાજ્યો/સંઘપ્રદેશોના મુખ્ય સચિવશ્રીઓની જાણ સારુ.